



Date: June 1, 2017

To,
Corporate Relations
The BSE Limited
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street, Fort,
Mumbai - 400 001

Respected Sir / Ma'am,

Sub: Publication of Audited Financial Results for the quarter and year ended March 31, 2017

Ref: Code No. 531637


Pursuant to Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we are enclosing herewith photocopy of the newspaper publications published in Free Press Gujarat, Ahmedabad (English version) dated June 1, 2017 and in Lokmitra, Ahmedabad (Gujarati version) dated June 1, 2017 for your reference and record.

Thanking you,

Yours' faithfully,

For, **SWORD & SHIELD PHARMA LIMITED**

DARSHIL HIRANANDANI
COMPANY SECRETARY AND COMPLIANCE OFFICER
(ACS - 47986)



FREE PRESS GUJARAT
Thursday, June 1, 2017

SmartestNightPhone Make your nights picture-perfect with PIXELEX Engine



"Do the undoable" is the brand philosophy of Tecno Mobile in India. The product proposition is built around breaking the boundaries of 'day' in the context of clicking pictures. A revolutionary shift from 'photography' to 'night photography' and from doing the 'doable' to doing the 'undoable'.


Tecno smartphones promise to #OwnTheNight with its unique image processing technology PIXELEX Engine. It enables you to capture the brightest pictures even in the darkest night by redefining the boundaries of image processing and user experience.

Now you can explore night photography with Tecno Mo-

bile and unlock the world of new possibilities. Globalisation is its core - All Tecno smartphones are specially 'Made for India' which reflects in the name of our latest range of smartphones 'Y'. The software algorithm of the camera is optimised as per the needs of Indian consumers - skin tone, colour preferences, contrast etc. It enables you to capture images true to Indian skin tones even in low light conditions.

Unlock with ease - Dinner fingers will never be an issue again. The new Anti-Oil Fingerprint Sensor allows you to unlock your phone anytime, anywhere under any condition. (19-8)

'Life in the Air' premiering on Sony BBC Earth



Tune-In: An extraordinary story is all set to hit your television screens this weekend. Sony BBC Earth takes you on an exceptional journey with the series 'Life in the Air' premiering on June 3, 2017 at 9:00PM in its weekend slot 'Earth Specials'.

Uncover never-seen-before secrets behind the flying techniques of animals and birds - from cats to kangaroos, squirrels to spiders, frogs to fish, and birds to bats. 'Fly' alongside the ani-

mals and see the world from their unique point of view as the series captures unusual animal behavior and reveals the amazing science of flight. The cutting-edge filming technology follows these animals into the skies, and reveal their hidden world. Experience the adventurous world of flying creatures and their life of jumping and gliding as never before from Saturday, June 3 @ 9:00PM only on Sony BBC Earth #FeelAlive. (20-4)

GUJARAT STATE ELECTRICITY CORPORATION LIMITED KUTCH LIGHTNITE THERMAL POWER STATION

S.K.V. Nagar, Panandhro, Kutch, Gujarat-370 601
GSECL: www.gsecl.com & P&T Dept-GOG: http://gup-epd.gov.in

TENDER-NOTICE no. e-TENDER KLTPS-19/2017-18. Tenders for Supply of various materials and other works are put on website: <https://gsecl.nprocure.com>, www.gsecl.com, www.gsecl.in. For Tender above Rs. 5.00 Lacs. Vendors/Manufactures and contractors are requested to view, down load, participate and submit online from <https://gsecl.nprocure.com>. Tender below Rs.5.00 Lacs may be view, download & participate only from www.gsecl.com / www.gsecl.in

1/c Chief Engineer (G), KLTPS.

Sony LePlex FPC 1 June, 2017

India Time	1-Jun-17 Thursday
5:50 AM	MUPPETS MOST WANTED
7:37 AM	ROBBER BRIDE
9:02 AM	SENSE & SENSIBILITY
11:12 AM	DANCE WITH ME
1:00 PM	HAIL, CAESAR!
2:59 PM	GLADIATOR
5:23 PM	LEGEND
7:35 PM	DATE & SWITCH
9:00 PM	BIG DADDY
10:28 PM	CARLITO'S WAY 2
12:08 AM	EVEREST
2:02 AM	KINDERGARTEN COP 2
3:36 AM	THE LIFE OF DAVID GALE

SWORD AND SHIELD PHARMA LIMITED

CIN: L24231GJ1995PLC024809
Registered Office: 55, World Business House, Near Parimal Garden, Ambawadi, Ahmedabad - 380 006
Website: www.swordandshieldpharma.com
Contact: +91 96250 79759

Extract of Audited Financial Results for the quarter and year ended on March 31, 2017.

Particulars	Quarter ended on 31/03/2017		Year Ended on 31/03/2017	
	Audited	Un-audited	Audited	Un-audited
Total Income From Operations	728,839.00	279,000.00	903,662.00	323,516.00
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	411,689.55	3,681,471.00	(2,453,122.95)	2,284,353.12
Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	411,689.55	3,681,471.00	(2,453,122.95)	2,284,353.12
Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	411,689.55	3,681,471.00	(2,453,122.95)	2,284,353.12
Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	-	-	-	-
Equity Share Capital	46,619,170.00	46,619,170.00	46,619,170.00	46,619,170.00
Reserves (excluding Revaluation Reserve as shown in the Audited Balance Sheet of the previous year)	(47,987,119.00)	(45,532,995.60)	(47,987,119.00)	(45,532,995.60)
Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)-				
1. Basic: (not annualized for the quarter ended)	0.880	0.715	(0.476)	0.444
2. Diluted: (not annualized for the quarter ended)	0.880	0.715	(0.476)	0.444

Note: The above financial is an extract of the detailed format of quarterly Financial Results filed with the Bombay Stock Exchange (BSE Ltd.) under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation, 2015. The full format of the quarterly Financial Results are available on the Bombay Stock Exchange Website at www.bseindia.com and on the website of the Company.

For: SWORD AND SHIELD PHARMA LIMITED
Place: Pennsylvania
Date: May 30, 2017

Sd/-
Pravinbhai Patel
Managing Director
DIN: 01877469

INTERACTIVE FINANCIAL SERVICES LIMITED

Regd. Office: A-1006, Premium House, B/h Handloom House, Ashram Road, Ahmedabad - 380009

STANDALONE AUDITED RESULTS FOR QUARTER AND YEAR ENDED ON 31st MARCH, 2017

(RS. IN LAKH)

Sl. No.	Particulars	Quarter Ended 31/03/2017		Year Ended 31/03/2016	
		(audited)	(un-audited)	(audited)	(un-audited)
1.	Total Income from Operations	22.05	42.86	27.89	
2.	Net Profit / (Loss) for the period (before tax, Exceptional and/or ordinary Items)	(13.01)	4.05	5.95	
3.	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	(12.97)	4.01	7.13	
4.	Net Profit/(Loss) for the period after tax (After exceptional and/or Extraordinary Items)	29.56	2.98	7.13	
5.	Total Comprehensive Income for the period (Comprising Profit/ (Loss) for the period (after tax) and other comprehensive Income (after Tax)	56.16	45.90	28.56	
6.	Equity Share Capital	301.31	301.31	301.31	
7.	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	(4.63)	(5.79)		
8.	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) -				
1. Basic:	0.98	0.10	0.24		
2. Diluted:	0.98	0.10	0.24		

Note: The above is an extract of the detailed format of Quarterly & Year Ended on 31st March, 2017 for financial year 2016-17. Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and other Disclosure requirement) Regulation, 2015. The full format of the Quarterly & Year ended financial results are available on the stock exchange website www.bseindia.com and on the website of the Company at ifinservices.com

BY ORDER OF THE BOARD
Sd/-
Kishore Vekariya
Director
DIN: 07822663

SHREE METALLOYS LIMITED

(Regd. Off-Regd. Off: A/2 NORTH VIEW APARTMENT, ST. XAVIERS COLLEGE ROAD, NAVRANGPURA, AHMEDABAD, GUJARAT-380009)

Email: shreemetalloysahd@gmail.com Website: shreemetalloys.com

Extract of Audited Financial Results for the Quarter & Year ended 31st March 2017

Particulars	Standalone		Corresponding 3 months ended in the previous year
	Quarter ending 31/03/2017	Year to date figures 01/04/2016 to 31/03/2017	
1. Total Income from operations	1252.43	4423.05	1,552.50
2. Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	17.88	24.75	25.56
3. Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	17.88	24.75	25.56
4. Net Profit/ (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	10.23	17.10	17.81
5. Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax))	N.A.	N.A.	N.A.
6. Equity share Capital	525.63	525.63	525.63
7. Reserve (excluding Revaluation Reserve) as shown in the Audited Balance sheet of the previous year	-	137.92	-
8. Earnings Per Share (of Rs.10/- each) (for continuing and discontinued operations)-			
1. Basic:	0.19	0.33	0.34
2. Diluted:	0.19	0.33	0.34

Note: The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the website of BSE Ltd (www.bseindia.com) and on the website of the Company (www.shreemetalloys.com)

* The Ind AS as prescribed in section 133 of the Companies Act, 2013 read with Companies (Indian Accounting Standard) Rules, 2015 is not applicable to the company for the Financial year 2016-17.

For and on behalf of the Board
SHREE METALLOYS LIMITED
Sd/-
Pratik R Kabra
Managing Director
DIN:00066358

Date: 30/05/2017
Place: Ahmedabad

President of India strongly condemns terror attack in Kabul

The President of India, Shri Pranab Mukherjee has strongly condemned the terror attack in Kabul today (May 31, 2017).

In his message to H. E. Dr. Mohammad Ashraf Ghani, the President of the Islamic Republic of Afghanistan, the President said, "I write to convey heartfelt condolences on behalf of the Government and people of India for the loss of innocent lives in the terror attack that took place in Kabul this morning."

This is yet another instance of senseless violence that cannot be justified under any circumstances.

SHRI ASTER SILICATES LIMITED

CIN: 14050199PLC025581
Regd. Off. Plot No. 831, B.N.H. House, Jagdish 02/02, Bhavnagar - 380010
Website: www.asterindia.com, Email: aster_india@yahoo.com

EXTRACT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31.03.2017

Particulars	Quarter Ended 31.03.2017		Year Ended 31.03.2016	
	Audited	Un-audited	Audited	Un-audited
Total Income From Operations	1819.04	(1636.17)	(3274.05)	3273.71
Net Profit from Ordinary Activities after tax (after extraordinary items)	1615.54	(1638.19)	(2074.65)	3558.11
Equity Share Capital	2352.68	2352.68	2352.68	2352.68
Earnings Per Share (EPS) (Before Extraordinary Items) (of Rs. 10/- each)*				
(a) Basic:	-16.88	-8.16	-15.21	-15.12
(b) Diluted:	-16.88	-8.16	-15.21	-15.12
(c) Basic:	-16.88	-8.16	-15.21	-15.12
(d) Diluted:	-16.88	-8.16	-15.21	-15.12

Note: The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results is available on the Stock Exchange Website www.bseindia.com and on the Company's website www.asterindia.com

On Behalf of the Board of Directors
For Shri Aster Silicates Limited
Sd/-
Isha M Bhojani
DIN: 07911812

Date: 01-06-2017
Place: Bhavnagar

CRESTCHEM LIMITED

CIN: L24000GJ1995PLC025580
Regn Office Address: Sr. No.550/2, Sub Plot No. 12, Village: Indrad, Taluka- Kadi, Mahesana- 382713 Email ID: info@crestchemlimited.in Website: www.crestchemlimited.in

AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER/YEAR ENDED 31st MARCH, 2017

Sr. No.	Particulars	Quarter ended 31.03.2017		Year ended 31.03.2016	
		Audited	Un-audited	Audited	Un-audited
1.	Income				
	Revenue from operations	2.16	2.66	6.51	14.04
	Other Operating Income	-	-	-	13.20
	Total Income from Operations (net)	2.16	2.66	6.51	14.04
	Other Income	2.08	2.05	2.06	6.23
	Total Income (net)	4.24	4.71	8.57	22.27
2.	Expenses				
	(a) Cost of Material Consumed	0.70	0.56	0.09	5.04
	(b) Purchase of Stock-in-Trade	(0.24)	(0.03)	1.09	(0.25)
	(c) Changes in Inventories of Finished Goods, Work-in-progress and stock-in-trade	(0.20)	(0.03)	1.09	(0.25)
	(d) Employee benefits expense	2.17	2.10	1.93	17.62
	(e) Finance Costs	1.26	1.20	0.84	4.35
	(f) Depreciation & amortization expenses	0.01	-	0.02	0.02
	(g) Other Expenses	3.20	4.59	1.78	16.67
	Total Expenses (a+b+c+d+e+f+g)	7.10	8.42	5.73	38.45
3.	Profit before tax (1-2)	(2.86)	(3.71)	2.84	(16.18)
4.	Tax Expenses				
	(i) Current Tax	-	-	1.00	-
	(ii) Deferred Tax	-	-	-	3.25
	Total Tax (i+ii)	-	-	1.00	3.25
5.	Profit for the period (3-4)	(2.86)	(3.71)	1.84	(16.18)
6.	Other Comprehensive Income	-	-	-	8.55
7.	Total comprehensive income for the period (5+6)	(2.86)	(3.71)	1.84	(16.18)
8.	Equity share Capital - Face Value of ₹ 10	300.00	300.00	300.00	300.00
9.	Earnings per equity share (EPS) in ₹ (not Annualized)				
	BASIC	(0.10)	(0.12)	0.06	(0.54)
	DILUTED	(0.10)	(0.12)	0.06	(0.54)

Note: (i) The above Audited Financial Results for the Quarter/Year ended March 31, 2017 have been reviewed by the Audit Committee and were taken on record by the Board of Directors in their respective meetings held on May 20, 2017.

(ii) The Company has adopted Indian Accounting Standards (Ind AS) from 1st April, 2016. The figures for the Quarter and Year ended 31st March, 2016 are Ind AS compliant.

(iii) The Company operates only in one segment viz. Nutrition- Chemical Industries.

(iv) The figures for quarter ended 31st March, 2017 are the balancing figures between the audited figures in respect of the full financial year and the year-to-date figures upto the third quarter of the financial year.

(v) Figures for the previous Period have been regrouped, reclassified and restated wherever necessary to make them comparable with the current period's figures.

(vi) Statement of reconciliation of net profit reported under Ind AS and net profit reported under previous Indian GAAP for the Quarter/Year ended March 31, 2016 are as under:

(vii) The figures for quarter ended 31st March, 2017 are the balancing figures between the audited figures in respect of the full financial year and the year-to-date figures upto the third quarter of the financial year.

(viii) Figures for the previous Period have been regrouped, reclassified and restated wherever necessary to make them comparable with the current period's figures.

(ix) Statement of reconciliation of net profit reported under Ind AS and net profit reported under previous Indian GAAP for the Quarter/Year ended March 31, 2016 are as under:

(x) Statement of Reconciliation between Total Equity previously reported under Ind AS and Previous Indian GAAP for the year ended 31st March, 2016 is as under:

(xi) Statement of Reconciliation between Total Equity previously reported under Ind AS and Previous Indian GAAP for the year ended 31st March, 2016 is as under:

(xii) Statement of Reconciliation between Total Equity previously reported under Ind AS and Previous Indian GAAP for the year ended 31st March, 2016 is as under:

(xiii) Statement of Reconciliation between Total Equity previously reported under Ind AS and Previous Indian GAAP for the year ended 31st March, 2016 is as under:

(xiv) Statement of Reconciliation between Total Equity previously reported under Ind AS and Previous Indian GAAP for the year ended 31st March, 2016 is as under:

(xv) Statement of Reconciliation between Total Equity previously reported under Ind AS and Previous Indian GAAP for the year ended 31st March, 2016 is as under:

(xvi) Statement of Reconciliation between Total Equity previously reported under Ind AS and Previous Indian GAAP for the year ended 31st March, 2016 is as under:

(xvii) Statement of Reconciliation between Total Equity previously reported under Ind AS and Previous Indian GAAP for the year ended 31st March, 2016 is as under:

(xviii) Statement of Reconciliation between Total Equity previously reported under Ind AS and Previous Indian GAAP for the year ended 31st March, 2016 is as under:

(xix) Statement of Reconciliation between Total Equity previously reported under Ind AS and Previous Indian GAAP for the year ended 31st March, 2016 is as under:

(xx) Statement of Reconciliation between Total Equity previously reported under Ind AS and Previous Indian GAAP for the year ended 31st March, 2016 is as under:

(xxi) Statement of Reconciliation between Total Equity previously reported under Ind AS and Previous Indian GAAP for the year ended 31st March, 2016 is as under:

(xxii) Statement of Reconciliation between Total Equity previously reported under Ind AS and Previous Indian GAAP for the year ended 31st March, 2016 is as under:

(xxiii) Statement of Reconciliation between Total Equity previously reported under Ind AS and Previous Indian GAAP for the year ended 31st March, 2016 is as under:

(xxiv) Statement of Reconciliation between Total Equity previously reported under Ind AS and Previous Indian GAAP for the year ended 31st March, 2016 is as under:

(xxv) Statement of Reconciliation between Total Equity previously reported under Ind AS and Previous Indian GAAP for the year ended 31st March, 2016 is as under:

(xxvi) Statement of Reconciliation between Total Equity previously reported under Ind AS and Previous Indian GAAP for the year ended 31st March, 2016 is as under:

(xxvii) Statement of Reconciliation between Total Equity previously reported under Ind AS and Previous Indian GAAP for the year ended 31st March, 2016 is as under:

(xxviii) Statement of Reconciliation between Total Equity previously reported under Ind AS and Previous Indian GAAP for the year ended 31st March, 2016 is as under:

(xxix) Statement of Reconciliation between Total Equity previously reported under Ind AS and Previous Indian GAAP for the year ended 31st March, 2016 is as under:

(xxx) Statement of Reconciliation between Total Equity previously reported under Ind AS and Previous Indian GAAP for the year ended 31st March, 2016 is as under:

(xxxi) Statement of Reconciliation between Total Equity previously reported under Ind AS and Previous Indian GAAP for the year ended 31st March, 2016 is as under:

(xxxii) Statement of Reconciliation between Total Equity previously reported under Ind AS and Previous Indian GAAP for the year ended 31st March, 2016 is as under:

(xxxiii) Statement of Reconciliation between Total Equity previously reported under Ind AS and Previous Indian GAAP for the year ended 31st March, 2016 is as under:

(xxxiv) Statement of Reconciliation between Total Equity previously reported under Ind AS and Previous Indian GAAP for the year ended 31st March, 2016 is as under:

(xxxv) Statement of Reconciliation between Total Equity

